Eim/Sec/SE 5th May, 2018

Bombay Stock Exchange Ltd.

Phiroze Jeejeebhoy Towers

25th Floor Dalal Street

Bombay - 400 001

National Stock Exchange of India Limited

Capital Market (Listing) Exchange Plaza, 5th floor

Plot No. C/1, G Block Bandra-Kurla Complex

Bandra (E)

Mumbai - 400 051

Company Code 523708

Symbol EIMCOELECO - Series EQ

Sub: Publication of Audited Financial Results for the Quarter and Financial Year ended on 31st March, 2018

Dear Sirs,

We are submitting herewith one copy each of Audited Financial Results (Standalone & Consolidated) for the Quarter and Finanical Year ended on 31st March, 2018 as published in the Business Standard (English) and Jaihind (Gujarati) dtd. Today i.e. 5th May, 2018.

Kindly take the same on record and acknowledge the receipt of the same.

Thanking you,

Yours faithfully,

For Eimco Elecon (India) Ltd.,

Bharti L. Isarani

Company Secretary & Compliance Officer

Encl: As above

Regd. Office & Works:

EIMCO ELECON (INDIA) LTD., Anand Sojitra Road, Vallabh Vidyanagar - 388 120. Gujarat, India.

Tel.: (02692) 230502, 230602, 230902, Telefax: (02692) 236506 Website: www.eimcoelecon.in | CIN: L29199GJ1974PLC002574

















Diwan Chowk, Diwan Complex, Junagadh – 362001, Ph. 0285-2652145, 2620144, Email: bo0238@pnb.co.i

APPENDIX IV [See Rule 8(1) POSSESSION NOTICE]



ing of held sider, if the

tors on loor pur, )84,

and ear

ted Sd/aig ficer 9058

# **EIMCO ELECON**

## EIMCO ELECON (INDIA) LTD.

CIN: L29199GJ1974PLC002574

Regd. Office: Anand - Sojitra Road, Vallabh Vidyanagar-388 120.

Ph: (02692) 230602 Fax: (02692) 236506. Email: investor@eimcoelecon.in Website: www.eimcoelecon.in EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED ON 31st MARCH, 2018

(₹ in Lacs)

		Standalone					Consolidated				
Sr.		Quarter Ended			Year Ended		Quarter Ended			Year Ended	
No.		31-03-2018	31-12-2017 31-03-2017		31-03-2018 31-03-2017	31-03-2018	31-12-2017	31-03-2017	31-03-2018	31-03-2017	
		Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations	6644.67	3528.60	5563.79	14216.55	18540.52	6644.67	3528.60	5563.79	14216.55	18540.52
2	Net Profit / (Loss) from ordinary activities after tax	871.29	580.76	1525.12	1644.44	2509.10	870.68	578.55	1529.19	1627.07	2471.61
3	Net Profit / (Loss) for the period after Tax (after Extraordinary items)	871.29	580.76	1525.12	1644.44	2509.10	870.68	578.55	1529.19	1627.07	2471.61
4	Total Comprehensive Income for the period [Comprising Profit for the period after tax and other comprehensive income after tax]	887.78	580.76	1510.76	1660.93	2494.74	887.17	578.55	1514.83	1643.56	2457.25
5	Equity Share Capital	576.84	576.84	576.84	576.84	576.84	576.84	576.84	576.84	576.84	576.84
6	Earnings Per Share (before extraordinary items) (of ₹ 10/- each)					(8)				1120	
1909	(a) Basic:	15.10	10.07	26.44	28.51	43.50	15.09	10:03	26.51	28.21	42.85
	(b) Diluted:	15.10	10.07	26.44	28.51	43.50	15.09	10.03	26.51	28.21	42.85
7	Earnings Per Share (after extraordinary items) (of ₹10/- each)									NAC STREET OF S	
500	(a) Basic:	15.10	10.07	26.44	28.51	43.50	15.09	10.03	26.51	28.21	42.85
	(b) Diluted : 10 to 10 t	15.10	10.07	26.44	28.51	43.50	15.09	10.03	26.51	28.21	42.85

Notes: 1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter / Year ended on 31st March, 2018 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com / www.nseindia.com) and Company's website www.eimcoelecon.in

2. The Company has only one reportable business segment i.e. Machinery and Spares which is applicable to standalone Results.

- 3. Revenue from Operations for period upto 30<sup>th</sup> June, 2017 included excise duty, which was discontinued from 1<sup>st</sup> July, 2017 on implementation of Goods and Service Tax (GST) in India In accordance with 'Ind AS 18, Revenue' GST is not included in Revenue from Operations. In view of the aforesaid restructuring of indirect taxes, Revenue from Operations for the quarter/ Year ended on 31<sup>st</sup> March, 2018 is not comparable with previous periods.
- 4. Consolidated statement includes shares in Associate : Eimco Elecon Electricals Ltd.
- 5. Figures of the previous quarters/ period have been regrouped/ restated wherever necessary.
- 6. The Board of Directors has recommended Dividend on equity shares @ Rs. 5 /- Per Share i.e. 50% for the year ended 31st March, 2018.

Place: Vallabh Vidyanagar Date: 3<sup>rd</sup> May, 2018 For Eimco Elecon (India) Limited,
M.G.Rao - Whole Time Director

# JAI HIND-AHMEDABAD

# બાંધકામ પ્રોજેકટની રજિસ્ટ્રેશન ફીમાં ૪૦ ટકાના ઘટાડાનો નિર્દેશ

માં ૪૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ સેવાઇ રહી છે. મળી રહ્યો છે. બીલ્ડરો પાસેથી

રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ આવી છે. એકાદ સમાહની અંદર ડેવલપમેન્ટ એક્ટની હેઠળ) રેરામાં જ રેરા ઓથોરીટી દ્વારા ફી ઘટાડાનો બાંધકામ પ્રોજેક્ટની રજીસ્ટ્રેશન ફ્રી નિર્ણય લેવામાં આવે તેવી શકયતા

રાજકોટમાં રેરામાં ૩૨૧ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ફીરજીસ્ટ્રેશન નામે સરકાર ૨જૂ કરવામાં આવ્યા છે તેમાંથી

# પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન ફીનું ધોરણ

૧. રહેણાંકઃ ૧૦૦૦ ચો.મીથી ઓછામાં પ્રતિ ચો.મી.એ રૂ.પાંચ અને તેથી વધુ જમીનમાં રૂ.૧૦ (મહત્તમ રૂ.૫ લાખ) ૨. રહેણાંક અને કોમર્શિયલઃ ૧૦૦૦ ચો.મીથી ઓછામાં પ્રતિ ચો.મી.એ

રૂ.૧૦, તેથી વધુ જમીનમાં રૂ.૧૫ (મહત્તમ રૂ.૭ લાખ) કક્ત કોમર્શિયલ: ૧૦૦૦ ચો.મીથી ઓછામાં પ્રતિ ચો.મી.એ 3.૨૦, તેથી વધ જમીનમાં 3.૨૫ (મહત્તમ 3.૧૦ લાખ)

૪. પ્લોટ ડેવલપમેન્ટઃ પ્રતિ ચો.મી.એ રૂ.૫ (મહત્તમ રૂ.૨ લાખ)

દ્વારા ઉઘરાવાતી ૨કમ ઘણી ઉંચી ૧૭૬ ને મંજુરી આપવામાં આવતા હોવાના કારણે પ્રોજેક્ટ પુરો કરવામાં આ પ્રોજેક્ટો શરૂ કરી દેવામાં આવ્યા બીલ્ડરોને મુશ્કેલી પડતી હોવાની છે. જ્યારે ૨૭ પ્રોજકેટનો મંજુરી કરીયાદ બાદ રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા કરવાનો નિર્દેશ મળી રહ્યો છે. રાજ્ય છે અને હજૂ ૮૨ પ્રોજે કટોની સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ફાઇલોની ચકાસણી કરવાની બાકી મંદીના કારણે બીલ્ડરોને રેરાની છે. બાંધકામ પ્રોજેક્ટમાં પ્રતિ ચોરસ રજીસ્ટ્રેશન ફ્રી પરવડતી ન હોવાની મીટરે રૂા.પ અને ૧૦ ની ફ્રી દલીલ મુખ્યમંત્રીને કરવામાં આવી ઉઘરાવવામાં આવી રહી છે. જે ફી છે અને તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવતા મુખ્યમંત્રી કાર્યાલય છે તેથી આ ફીમાં ઘટાડો કરવાની

ઉંચી હોવાનું બીલ્ડર લોબીનું માનવું દ્રારા રેરા ઓથોરીટીને ૪૦ ટકા કી માગણી કરવામાં આવી છે. તેના

# દિલ્હીના પ્રદૂષણના સ્તરમાં સુધારો :પર્યાવરણ મંત્રાલય

# દિલ્હીની ઝેરીલી હવાના રિપોર્ટ પર સરકારને વિશ્વાસ નથી!!

ન્યુ દિલ્હી તા. ૪

અટક બદલેલ છે

મારૂ નામ કાગઝી અબુઝર

અબ્દુલ રશીદથી બદલીને શેખ

અબુઝર અબ્દુલ રશીદ રાખેલ

છે. સરનામું: ૨૪૭૨,

લાલસ્કુલ નં. ૪, શાહપુર,

અમદાવાદ

જીનિવામાં વર્ષ ૨૦૧ ૬ માટે ડબ્લ્યુએચઓ દ્વારા જારી કરાયેલ દનિયાભરનાં ૧૫ સૌથી પ્રદષિત શહેરની યાદીને લઇને પ્રદષણ નિયંત્રણ સંસ્થા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અને પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે તેનાથી પ્રદૂષણના સ્તરની સ્પષ્ટ તસવીર દેખાતી નથી. તેમનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો છે અને હાલની સ્થિતિ રિપોર્ટથી હટીને છે .

૨૦૧૭માં પ્રદૂષણ સામે લડવા માટે ઘણાં પગલાં લેવાયાં, જેમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુએચઓ દ્વારા જારી લિસ્ટમાં દુનિયાનાં ૧૫ સૌથી પ્રદુષિત શહેરમાં દિલ્હીનું સ્થાન છુટું છે. આ રિપોર્ટ મુજબ દિલ્હીની હાલત ૨૦૧૦ કરતાં પણ ખરાબ થઇ છે. ૨૦૧૦માં દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું.

એ સમયે દિલ્હીની હવામાં ૨.૫ લેવલ ૧૪૧ માઇક્રોગ્રામ પ્રતિકયુબિક મીટર નોંધાયું હતું, જે ૨૦૧૬ સુધીમાં વધીને ૧૪૩ માઇક્રોગ્રામ પ્રતિકયુબિક મીટર થઇ ગયું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં પરિસ્થિતિ સુધરી છે અને ૨૦૧૮માં તો ૨૦૧૬ની સરખામણીમાં ઘણી સારી સ્થિતિ છે.

# દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયલ માહિતી વેચવા પર રોક લાગશે

ન્યુ દિલ્હી,તા.૪ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે જેનાથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી વેચવા પર રોક લાગશે. પ્રસ્તાવિત કાયદામાં માહિતી વેચવાના નિયમમાં ઉલ્લંઘન કરવા બદલ પાંચ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ હશે.

ડિઝિટલ ઈન્ફોર્મેશન સિક્ચોરિટી ઈન હેલ્થકેર એક્ટ (દિશા) લાગુ થયા બાદ સ્વાસ્થ્ય ડેટાને ચેક કરીને તેને દવા અથવા જીવન વીમા કંપ્રીઓને વેચનારી કંપ્રીઓ અથવા સંસ્થાન સરકારના રડારમાં આવી જશે. કાયદાના ડ્રાફ્ટ અનુસાર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ડિઝિટલ જાણકારી ખાનગી અને સુરક્ષિત રાખવામાં આવશે અને તેને કોઈ વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે તેનો ખુલાસો અથવા ઉપયોગ કરી શકાય તેમ નથી.

વીમા કંપ્રીઓ પણ પોલિસી ખરીદી રહેલા કોઈ વ્યક્તિનો ડિઝિટલ હેલ્થ ડેટા હાંસલ કરી શકશે નહીં. માત્ર વીમા દાવાના ઉકેલ દરમિયાન વિશેષ પરિસ્થિતિઓમાં જ તેનો ઉપયોગ સંબંધિત વ્યક્તિ અથવા તેના વારસદારની અનુમતિથી થઈ શકશે.

બિલના ડ્રાફ્ટ અનુસાર કોઈ વ્યક્તિના ડિઝિટલ હેલ્થ ડેટાને હાંસલ કરવો, તેનો ઉપયોગ કરવો અથવા તેને વ્યવસાયિક હેતથી કોઈને આપવો દંડનીય અપરાધ ગણાશે.

રાજકોટ તા.૪ નો ઘટાડો કરવાની દરખાસ્ત કરવામાં પગલે મુખ્યમંત્રી દ્વારા કી ઘટાડાની દરખાસ્ત કરવામાં આવી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી હાલમાં રજિસ્ટ્રેશન ફ્રી પેટે પ્રોજેક્ટના પ્રકાર અનુસાર પ્રતિ ચો.મી.એ પાંચ રુપિયાથી લઈ રુ. ૨૫ સુધી વસૂલે છે. જો કે, ૧૦૦૦ ચો.મી.થી વધ્ ક્ષેત્રફળની જમીનમાં આ ગણતરીએ કીની રકમ મહત્તમ પાંચ લાખથી ૧૦ લાખની મર્યાદામાં રહે તેવી કેપ પણ

સિવાયના વિસ્તારોમાં જ્યાં પ્રોજેક્ટ કોસ્ટ ઓછી હોય ત્યાં ફીના દરો ડેવલપર્સ, બિલ્ડર્સને પોષાય તેમ નથી. તેવ કારણ આપીને ફેરવિચારણા માટે મુખ્યમંત્રી કાર્યલાયે દરખાસ્ત મોકલી છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવે તે પછી વિચાર કરીને નિર્ણય લેવા માટે ઓથોરિટી સ્વતંત્ર છે તેમ ઓથોરીટીના સુત્રોએ મુકવામાં આવી છે. ફાસ્ટગ્રોથ એરિયા જણાવ્યુ હતુ. કેટલા ઘટાડાની

AHMEDABAD MUNICIPAL CORPORATION-SOUTH ZONE South Zone office Building, Rambaug. Maninagar, Ahmedabd Short E-Tender Notice No.-01/2018-19 Road Tender-17, Water Tender-05, Drainage/SWD Tender-39,

(1)	Date of online Submission	:- Dt.07-05-2018 to Dt.18-05-2018 Up to 18.00 Hrs.
(2)	Date of physical Submission	:- Dt 19-05-2018 Up to 16.00 Hrs
(3)	Tender Opening Date	:- To be intimated after technical bid eveluation

in www.amc.nprocure.com and www.nprocure.com મ્યુનિસિપલ સેવાને લગતી ફરીયાદ માટે ડાયલ કરો:૧૫૫૩૦૩ દરખાસ્ત મુદ્દે તેમણે કોઈ ક્રોડ પાડયો

ન હતો પરંતુ, સરકારે ૪૦ ટકા સુધી ઘટાડો સચવ્યાનું જાણવા મળ્ય છે.

#### The Court of A.D.J. 1st Patna City Probate Case No. 82 of 2015 Anant Kumar Mehta versus the Estate of Late

Godawri Devi. Notice to : Mrs. Sushila N. Joshi, wife of

Mr. Naresh N. Joshi, resident of C/5, Shipki Apartment, Nr. Sanjeevani Hospital, New Sharda Mandir Road, Ahmedabad, Pin - 380 007

Wheres the above named petitioner Anant Kumar Mehta has filed this Probate petition for grant of probate in respect of the last will and testament dated 17-12-2004 executed by Late Godawari Devi in his favour.

And whereas notices were sent to you but did not appear. Therefore by this publication you are directed to appear before me on 16-5-2018 at 7 a.m. in person or through your duly apponted Lawyer and file objection if any failing which the matter will be heared and order shall be passed in your absence.

Given under my hands and the seal of the court on this 18th day of April, 2018.



Sd/-A.D.J. 1st Patna City (Patna) 18-4-2018

STANDALONE

# -ઃ જાહેર નોટીસ :-

## નગર રચના યોજના નં.૨૮ (નવાવાડજ) (ચોથો ફેરફાર)

આથી જાહેર જનતાને જણાવવાનું, કે મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૨૮ (નવા વાડજ) (ચોથો ફેરફાર)ની હદમાં સમાવિષ્ટ તમામ બ્લોક નંબરોની જમીનોના જમીન માલીકો/હિત સંબંધ ધરાવનાર તમામ વ્યક્તિઓને અત્રેની કચેરી દ્વારા પ્રાપ્ત કરેલ સરનામાઓને આધારે મુસદ્દારૂપ નગર રચનાની દરખાસ્તો અન્વયે વાંધા સૂચનો આવકારવા માટે વ્યક્તિગત નોટીસ બજાવવામાં આવેલ છે. પરંતુ ઘણા ખરા કેસોમાં સરનામાના અભાવે અથવા અન્ય કારણોસર નોટીસ બજી ન હોય તો રજીસ્ટર એડી અથવા સ્થળ ઉપર પંચનામુ કરી નોટીસ બજાવવામાં આવેલ છે. આમ, છતાં કોઈ જમીન માલિક કે હિત સંબંધ ધરાવનાર વ્યક્તિને સદર નોટીસ કોઈ કારણસર મળેલ ન હોય તો તેઓએ માલિકી હક્ક હિત સંબંધના પુરાવા રજુ કરી નોટીસની નકલ અત્રેથી ૩બ૩માં મેળવી આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૧૦ (દશ)માં નીચે જણાવેલ સરનામે આવેલ કચેરીમાં જાહેર રજાઓ સિવાયના દિવસોએ કચેરી સમય દરમ્યાન જરૂરી રજુઆત કરી જવા આથી જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં નહીં આવે તો સંબંધિત જમીનો અંગે અત્રેથી લેવામાં આવેલ નિર્ણય જે તે જમીન માલિકો હિત સંબંધ ધરાવનારાઓને બંધનકર્તા રહેશે. જેની નોંધ લેવા વિનંતી છે.

કચેરીનું સરનામું:-(આર.એમ.પટેલ) નગર રચના અધિકારીની કચેરી નગર રચના અધિકારી નગર રચના યોજના એકમ-૧૦ નગર રચના યોજનાઓ એકમ-૧૦ ઔડા બિલ્ડિંગ, ત્રીજો માળ, અમદાવાદ આશ્રમ રોડ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪

CONSOLIDATED

ક્રમાંક/સંમાનિ/અમદ/૨૪૬/૨૦૧૮-૧૯

# **ELECON ENGINEERING COMPANY LIMITED**

CIN: L29100GJ1960PLC001082

Regd. Office: Anand-Sojitra Road, Vallabh Vidyanagar - 388 120, Gujarat. Ph: (02692) 237016 Fax: (02692) 227020

Email: investor.relations@elecon.com Website: www.elecon.com

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 315 MARCH, 2018 (₹ in Lakhs)

Sr. No.		0.1711127120112			CONTOCLIDATED			
			Year Ended	Quarter Ended	Quarter Ended	Year Ended	Quarter Ended	
			31-03-2018	31-03-2017	31-03-2018	31-03-2018	31-03-2017	
			Audited			Audited		
1	Total Income from Operations	37487.35	93009.44	37110.19	43974.71	119397.44	44962.66	
2	Net Profit / (Loss) for the period (before Taxes, Exceptional and/or Extraordinary items)	4760.06	508.67	6266.23	5040.73	561.96	6370.63	
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	4760.06	508.67	6266.23	5040.73	561.96	6370.63	
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	5016.81	808.37	2909.54	5338.02	748.50	3004.72	
5	Total Comprehensive Income for the period							
	[Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	5080.41	819.78	2856.34	4826.47	199.28	2889.46	
6	Equity Share Capital, Paid-up equity share capital (Face Value of the share ₹ 2/-)	2244.00	2244.00	2244.00	2244.00	2244.00	2244.00	
7	Reserves (excluding Revaluation Reserves)		70829.88			68643.19	-	
8	Earnings Per Share (of ₹ 2/- each) (for continuing and discontinuing operations):							
	(a) Basic	4.47	0.72	2.59	4.76	0.67	2.68	
	(b) Diluted	4.47	0.72	2.59	4.76	0.67	2.68	

# Notes:

- 1. The above is an extract of the detailed format of Quarterly and Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchanges website (www.bseindia.com & www.nseindia.com) and on the website of the Company.
- The statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
- 3. The above Financial Results were reviewed and recommonded by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on
- 4" May, 2018. The Board of Directors has recommended a dividend at the rate of ₹ 0.20 per share of face value of ₹ 2 each aggregating ₹ 270.53 Lakhs (including corporate
- dividend tax of ₹ 46.13 Lakhs ) for the year ended 31st March, 2018.

The Consolidated Financial Results have been prepared in accordance with Ind AS 110 "Consolidated Financial Statement" and Ind AS 28 "Investments in Associates and Joint Ventures".

For and on behalf of Board of Directors Prayasvin B. Patel

Chairman & Managing Director DIN: 00037394

# **EIMCO ELECON**

Place: Vallabh Vidyanagar

Date: 4" May, 2018

# EIMCO ELECON (INDIA) LTD. CIN: L29199GJ1974PLC002574

Regd. Office: Anand - Sojitra Road, Vallabh Vidyanagar-388 120.

Ph: (02692) 230602 Fax: (02692) 236506. Email: investor@eimcoelecon.in Website: www.eimcoelecon.in

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED ON 31st MARCH, 2018

(₹ in Lacs) Consolidated Sr. Year Ended Quarter Ended Quarter Ended Year Ended **Particulars** 31-03-2018 31-12-2017 31-03-2017 31-03-2018 31-03-2017 31-03-2018 31-12-2017 31-03-2017 31-03-2018 31-03-2017 Unaudited Audited Unaudited Audited Audited Audited Audited Audited Audited Audited Total Income from Operations 6644.67 3528.60 5563.79 14216.55 18540.52 6644.67 3528.60 5563.79 14216.55 18540.52 Net Profit / (Loss) from ordinary activities after tax 871.29 580.76 1525.12 1644.44 2509.10 870.68 578.55 1529.19 1627.07 2471.61 Net Profit / (Loss) for the period after Tax (after Extraordinary items) 871.29 580.76 1525.12 1644.44 2509.10 870.68 578.55 1529.19 1627.07 2471.61 Total Comprehensive Income for the period [Comprising Profit for the 887.78 580.76 1510.76 1660.93 2494.74 887.17 578.55 1514.83 1643.56 2457.25 period after tax and other comprehensive income after tax] Equity Share Capital 576.84 576.84 576.84 576.84 576.84 576.84 576.84 576.84 576.84 576.84 6 Earnings Per Share (before extraordinary items) (of ₹10/- each) (a) Basic : 43.50 26.51 42.85 15.10 10.07 26.44 28.51 15.09 10.03 28.21 15.10 10.07 26.44 28.51 43.50 15.09 10.03 26.51 28.21 42.85 Earnings Per Share (after extraordinary items) (of ₹10/- each) 42.85 (a) Basic : 15.10 10.07 26.44 28.51 43.50 15.09 10.03 26.51 28.21 (b) Diluted :

26.44

43.50

28.51

15.09

10.03

26.51

Notes: 1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter / Year ended on 31st March, 2018 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com / www.nseindia.com) and Company's website www.eimcoelecon.in

10.07

2. The Company has only one reportable business segment i.e. Machinery and Spares which is applicable to standalone Results.

15.10

3. Revenue from Operations for period upto 30" June, 2017 included excise duty, which was discontinued from 1" July, 2017 on implementation of Goods and Service Tax (GST) in India. In accordance with 'Ind AS 18, Revenue' GST is not included in Revenue from Operations. In view of the aforesaid restructuring of indirect taxes, Revenue from Operations for the quarter/ Year ended on 31st March, 2018 is not comparable with previous periods.

- Consolidated statement includes shares in Associate : Eimco Elecon Electricals Ltd.
- Figures of the previous quarters/ period have been regrouped/ restated wherever necessary.
- The Board of Directors has recommended Dividend on equity shares @ Rs. 5 /- Per Share i.e. 50% for the year ended 31" March, 2018.

Place: Vallabh Vidyanagar Date : 3" May, 2018

For Eimco Elecon (India) Limited, M.G.Rao - Whole Time Director

28.21



42.85